

નમૂળો ક  
(જુઓ નિયમ ઉ (૧))  
માહિતી મેળવવા માટેની અરજીનો નમૂળો  
આઈ.ડી.ક્રમાંક.  
(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ

જાહેર માહિતી અધિકારી,  
(વિભાગ / કચેરી )

૧. અરજદારનું નામ :
૨. પૂરુ સરનામું :
૩. જરૂરી માહિતીની વિગતો (ટૂકમાં) :
૪. હું, આથી જણાવું છું કે માંગવામાં આવેલી માહિતી, માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૮ અથવા ૮ ડેટા માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ ડેટા આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ / કચેરીને લગતી છે.
૫. \* (૧) મેં વિભાગ / કચેરીમાં તારીખ : ..... ના રોજ પહોંચ ક્રમાંક : ..... પ્રમાણે  
રૂ. ..... શબ્દોમાં રૂપિયા ..... ની ફી ચુકવેલી છે.
- \* (૨) હું આ સ્પષ્ટે ચુકવવાપાત્ર ફી પેટે ..... અધિકારીની તરફેણમાં  
..... બેઠે કાઢી આપેલ તારીખ : ..... નો ડિમાન્ડ ફ્રાફ્ટ / પે  
ઓર્ડરનું બિડાણ કરું છું.
- \* (૩) આ અરજ ઉપર રૂ. ..... ની નોંન જયુરિશિયલ સ્ટેમ્પ ચોંટાલેલ છે.

સ્થળ:

અરજદારની સહી

તારીખ :

ઇ-મેઈલ એડ્રેસ, જો હોય તો

ટેલીફોન નં. (કચેરી):

(નિવાસ):

તા.ક : ગારીબી રેખા ડેટાની વ્યક્તિત્વે કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહિએ.

\* લાગુ પડતું ન હોય તે છેકી નાંખવું.